WWW.FINANCIALEXPRESS.COM

Shristi Infrastructure Development Corporation Limited Regd. Office: Plot No. X-1, 2 & 3, Block-EP, Sector-V, Salt Lake City, Kolkata- 700091 CIN: L65922WB1990PLC049541 | Tel : +91 33 4020 2020, Fax : +91 33 4020 2099 Website: www.shristicorp.com, Email: investor.relations@shristicorp.com

### NOTICE OF POSTAL BALLOT

Members of the Company are hereby informed that pursuant to Section 108, 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 read with Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014 (including any statutory modification(s) or re-enactment(s) thereof for the time being in force) ('the Act') and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, a Postal Ballot Notice together with Postal Ballot Form ('Postal Ballot Notice'), seeking Members' consent for the resolutions (a) Approval of Related Party Transactions and (b) Re-appointment of Managing Director of the Company, has been despatched.

The Company has on Saturday, 29th February 2020 completed the despatch of the Postal Ballot Notice to all Members whose names appear on the Register of Members/List of Beneficial Owners as on Friday, 21st February 2020. The Postal Ballot Notice has been sent (i) through electronic mode to the Members whose email IDs are registered with the Depository Participants and/or the Registrar and Share Transfer Agents; and (ii) through physical mode, along with postage prepaid self-addressed business reply envelope to those Members whose email IDs are not so registered. The voting rights of the Members shall be reckoned on the basis of equity shares of the Company held by them as on Friday, 21st February 2020 ('Cut-off date'). Any person who is not a Member on the Cut-off date shall treat this Postal Ballot Notice for Informational purposes only

The Company is pleased to provide e-voting facility to all its Members, to enable them to cast their votes electronically (e-voting) on the resolutions set out in the Postal Ballot Notice and has engaged the services of KFin Technologies Private Limited ('KFintech') as the Agency to provide e-voting facility. Detailed instructions and information relating to voting including e-voting, are set out in the Postal Ballot Notice despatched to the Members.

Members are requested to note that the voting, both through Postal Ballot and through e-voting, shall commence from Sunday, 1st March 2020 from 9:00 A.M. (IST) and end on Monday, 30th March 2020 at 5:00 P.M. (IST).

The Board of Directors has appointed CS Deepak Kumar Khaitan, Practicing Company Secretary, Deepak Khaitan & Co. (FCS No. 5615, CP No. 5207) and/or CS Shruti Singhania (FCS 49632, CP No. 18028) as the Scrutinizer for conducting the Postal Ballot (including e-voting process) in a fair and transparent manner. Members are requested to note that the duly completed and signed Postal Ballot Form should reach the Scrutinizer not later than 5:00 p.m. (IST) on Monday, 30th

The e-voting module shall be disabled by KFintech after 5:00 P.M. (IST) on Monday 30th March 2020. Postal Ballot Forms received after 5:00 P.M. (IST) on Monday, 30th March 2020 will be considered as invalid. In case of receipt of vote by both the modes, voting through e-voting shall prevail and voting by Postal Ballot Form

Members who have not received the Postal Ballot Notice or wish to vote

through physical Postal Ballot, may download the Postal Ballot Form from

https://evoting.karvy.com or from the Company's website www.shristicorp.com where the Postal Ballot Notice is displayed or they may request for a duplicate Postal Ballot Form from KFintech. The Postal Ballot Notice along with the Postal Ballot Form is also available on the website of the Stock Exchanges. In case of any queries/grievances, in relation to voting through post or electronic

means, you may contact to Registrar and Transfer Agent (RTA) i.e. KFin Technologies Private Limited, Selenium Tower-B, Plot 31-32, Gachibowli Financial District, Nanakramguda, Hyderabad-500032 or write an email to einward.ris@kfintech.com or to the Company at investor.relations@shristicorp.com.

The result of Postal Ballot shall be declared by the Chairman or any other authorized person of the Company on or before Wednesday, 1st April 2020 at the Registered Office of the Company and shall be uploaded on the website of the Company www.shristicorp.com and KFintech https://evoting.karvy.com. The results so announced shall also be communicated to the Stock Exchanges where the shares

of the Company are listed. By order of the Board of Directors

Place: Kolkata

Manoj Agarwal VP (Corporate Affairs) & Company Secretary

per Unit

For Shristi Infrastructure Development Corporation Limited

Record Date

# SHRISTI

With extension, Sebi chief Tyagi to have third-longest term

year and the first chairman, SA

Dave, for almost two years and

four months. Sebi was set up

in 1988 under an administra-

tive arrangement and was

given statutory powers only

with the enactment of the Sebi

cer of the Himachal Pradesh

cadre, will continue until the

government finds his successor.

He was an additional secretary

at the finance ministry before

taking on the Sebi role in March

2017. Among the senior bu-

reaucrats, economic affairs sec-

retary Atanu Chakraborty and

corporate affairs secretary Injeti

Srinivas are learnt to be key con-

tenders for the top Sebi job.

The government has got close to

two dozen applications. Sebi

whole-time member Madhabi

Puri Buch is also reportedly an-

other contender.

Tyagi, a 1984-batch IAS offi-

Act, 1992.

**FE BUREAU NEW DELHI, FEBRUARY 29** 

THE GOVERNMENT HAS notified a six-month extension to Ajay Tyagi's three-year term as the chairman of the Securities and Exchange Board of India (Sebi) beyond February 29, as it seeks to ensure regulatory stability in the face of a massive sell-off in global stock markets following the cornonavirus outbreak in China. With this, Tyagi will have the third-longest tenure at the helm of the stocks market regulator, trailing that of only DR Mehta (February 21, 1995 to February 20, 2002) and UK Sinha (February 18, 2011 to March 01, 2017).

In a late-night gazette notification on Friday, the finance ministry said: "... the central government hereby extends the term of appointment...for a period of six months beyond February 29 or until further orders, whichever is earlier."

Since its inception, Sebi has had nine chairmen, three of whom (GN Bajpai, N Damodaran and CB Bhave) have served the usual three-year period.GVRamakrishna was at the helm for almost three years and five months, while SS Nadkarni occupied the post for just over a

# SBI for same lending in jewellery, gems sector

**INDRONIL ROYCHOWDHURY** Kolkata, February 29

**PUBLIC SECTOR LENDER** State Bank of India is trying to bring about uniformity in its lending practices to the gems and jewellery sector, where lending growth has been largely muted following incidence of frauds. SBI was working on a policy framework to standardise lending practices to the gems and jewellery sector and was looking forward to extend it to other banks through Indian Banks'Association.

PN Prasad, SBI's deputy managing director, commercial clients group -1, told *FE* on the sidelines of an ICC session that at present SBI's exposure to the gems and jewellery sector was ₹20,000 crore and exposure to the diamond industry was ₹5,800 crore. "This low exposure to the sectorwas mainly because of a distrust created between lender and the borrower," Prasad said. While peak exposure to the sector never crossed ₹25,000 crore, SBI has liberalised its lending policy to the sector after reviewing it every year.

"In most cases borrowers have not been compliant with the norms and not many revised proposals do come in after a proposal is rejected on noncompliance ground," Prasad said, adding "till 2008 SBI's branch at Mumbai, catering exclusively to the diamond sector, had zero NPA. But lots of misery have happened to the banks for uncouth practices of the sector". Banks are comfortable to lend when there are transparency in issues like ownership, professional management, valuation, ratings exposure to insurance, reporting structure, quality and transaction.

## Reliance picks up 37.7% stake in Alok Industries

PRESS TRUST OF INDIA New Delhi, February 29

**RELIANCE INDUSTRIES ON** Saturday said it has acquired 37.7% stake in textile manufacturer Alok Industries for ₹250 crore. Reliance had jointly with JM Financial Asset Reconstruction bid for acquiring Alok Industries that was auctioned under the insolvency and bankruptcy law by lenders to recover their unpaid loans.

The Ahmedabad bench of the NCLT had last year approved the joint bid. "Please note that in accordance with the approved Resolution Plan, ALOK has today allotted 83.33 crore equity shares of ₹1 each at a premium of ₹2 per equity share for cash at total consideration of ₹250 crore to RIL," Reliance Industries (RIL) said in a regulatory filing.

financialexp.epa

Govt's total receipts at ₹12.82 lakh cr in April-Jan

THE GOVERNMENT'S TOTAL receipts during the April-January period of current fiscal stood

at ₹12.82 lakh crore, while total expenditure for the said period was ₹22.68 lakh crore. *PTI* 

Himatnagar Branch, C.S.2876, Vasant Bhuvan, Near Amarsinhji Shopping Mall, Tower Road, Himatnagar - 383 001 Cell :9909020780, 02772 - 245780 Email: Himatnagar@tmbank.in CIN: U65110TN1921PLC001908

Auction Sale notice

[Rule 8(6) And 9(1) of Security Interest (Enforcement) Rules 2002] Auction Sale Notice for sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002 Notice is hereby given to the public in general and in particular to the Borrower(s), mortgagor(s) and Guarantor(s) that the below described immovable property mortgaged to the Secured Creditor, the constructive possession of which has been taken by the Authorised Officer of Tamilnad Mercantile Bank Limited., Himatnagar Branch, (Secured Creditor), will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on 19.03.2020 for the recovery of a sum of Rs.24,16,299/- (Rupees Twenty Four Lakhs sixteen thousand Two hundred and ninety-nine only) as on 31.01.2020 due to Tamilnad Mercantile Bank Limited., Himatnagar Branch (Secured Creditor) from M/s. Tulip Enterprise (Proprietor Mr. Mohammadmunaf Sirajhussain Kadri). The Reserve Price for Shop No.D/7 & D/8 will be Rs. 4,27,000/- (Rupees Four Lakhs twenty seven thousand only) and the earnest money deposit will be Rs. 42,700/- (Rupees fourly two thousand and seven hundred only)

M/s TULIP ENTERPRISE Sole Prop.Mr. Mohammadmunaf Sirajhussain Kadri Kohinoor Complex, Markaz Road, Nyay Mandir Himmatnagar 383001, Sabarkanta District. Mr. Mohammadmunaf Sirajhussain Kadri ...Borrower/Mortagor

Sole Prop. M/s TULIP ENTERPRISE Kohinoor Complex, Markaz Road, Nyay Mandir Himmatnagar, Sabarkanta District Mr.Chandmohammad Mubarkaali Shekh Son Of Mr. Mubarakbhai Shekh

147-2 Hazipura Vsahat, Behind Old Central Bank, Himmatnagar 383001, Sabarkanta District Mr.Bhagwatbhai Bansilal Chavla Son of Bansilal Girdharji Chavla 391, Shaktinagar, Kenalpatti, Himmatnagar 383001, Sabarkanta District.

Description of Immovable Property

On Equitable Mortgage of Commercial Shop No.D/7 to the extent of 17.10 Sq.mtrs and Shop No.D/8 to the extent of 17.10 Sq.mtrs constructed at Ground Floor, Survey No.35, situated at Sunrise Ifra Complex, Virpur Village, Ta-Himatnagar within the limit of Virpur Gram panchayat, Himatnagar, sabarkanta District. Property belongs to Mr.Mohammadmunaf Sirajhussain Kadri Boundaries: North - Open land, South - Shop No.6, East - Open Land, West - Shop No.9 & 10

Tamilnad Mercantile Bank Ltd, Himatnagar Branch, Place of Auction C.S.2876, Vasant Bhuvan, Near Amarsinhji Shopping Mall, Tower Road, Himatnagar - 383001, Sabarkanta Dist. Phone - 02772-245780, 99090 20780.

Date and Time of Auction Sale 19.03.2020 at 12.00 PM Shop No.D/7 & D/8 - Rs. 4,27,000/- (Rupees Four Lakhs twenty Reserve Price seven thousand only)

The intending bidders should pay Ten Percent (10%) of the reserve price of the property as Earnesi Money Deposit (EMD) by means of a "Demand Draft" drawn in favour of "Tamilnaid Mercantile Bank Ltd" payable at Himatnagar Branch on or before, 19,03,2020 within 11,30 A.M. For detailed terms and conditions of the sale, please refer to the link provided in secured creditor's website (www.tmb.in) **Authorised Officer** 

Tamilnad Mercantile Bank Limited Date: 29.02.2020 Ahmedabad Regional Office. Place: Himatnagar (For Himatnagar Branch)

### NOTICE

Hereby it is informed to all that my client's Mr. Santosh Kakuram Jagtap and Mrs. Chhaya Santosh Jagtap, resident at Mohite Patil Nagar, B/9/199, Near to Hindustan bank, Mankhurd, Mumbai-400 043, original document of possession of their own flat no. I-20, 1" floor, Shree Dyaneshwar Mauli CHS, Survey no - 80/2, Vichumbe, Panvel, Dist. Raigad, registered with Sub-registar Panvel-3, registration no- P.V.L-3/2/20/2009 and same registration index no-2 has lost. Regarding this my client has filed a complaint with Mankhurd Police station, Mumbai - 400 043. Complaint no 1810, dated 20th November 2019. If anybody is having these documents and /or if anyone gets them please send/submit them to my client or at Mankhurd Police station immediately

It is also informed here that in case of above mentioned flat of my client if anyone is having objection with respect to NOC. Agreement of sale, Sale Deed, Exchange loan, Burden, Donation, Trust, Ownership, Rent, Transfer, Lien, or other things. Its requested that to come within 15 days (fifteen days) to the address of undersigned Advocate Mr. Satish Shinde. If it is not done then it will be considered that no one is having any type of objection regarding ownership on the said room, and even if anyone is having then it will be considered as relinquished by that party.

Date - 27/ 02/ 2020 Adv. Satish Shinde (Highcourt)

Shop no-3, Mhadda Shopping centre, Koyana Building Near Behind P.M.G.P. Police chowki, Mankhurd (W), Mumbai - 400 043. | Mobile: 9022259175 / 7738734606 Mr. Santosh Jagtap - 9222962086 | Email - advsatishinde@gmail.com

DEBTS RECOVER'  Govt. of India, Minis  3rd floor, Bhikhubhai Chambers, Nr. Kochrab Ashram Form No. 14 [See Regu	try of Finance , Paldi, Ahmedabad-380006. Ph.: 079-26579343	
RP/RC No. 07/2015	O.A. No. 62/2013	
State Bank of India	Certificate Holder Bank	
V/S.		
Dilipbhai Jayantibhai Nathwani & Anr.	Certificate Debtors	
DEMAND NO	TICE	

C.D. No. 1 Dilipbhai Jayantibhai Nathwani Legal heirs

1/A Sulekhaben J. Nathwani 2/B Rupaben J. Nathwani 3/C Jeet Dilipbhai Nathwani

2 Jeet Dilipbhai Nathwani

FORM A PUBLIC ANNOUNCEMENT

(Under Regulation 6 of the Insolvency and Bankruptcy Board of India

(Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016)

FOR THE ATTENTION OF THE CREDITORS OF M/S INDEPENDENT TV LIMITED

RELEVANT PARTICULARS

26.02.2020

24.08.2020

Anup Kumar

14.03.2020

Notice is hereby given that the Hon'ble National Company Law Tribunal, Mumbai Bench has ordered the

commencement of a Corporate Insolvency Resolution Process of the M/s Independent TV Ltd.

The creditors of M/s Independent TV Ltd. are hereby called upon to submit their claims with proof on or

The Financial Creditors shall submit their claims with proof by electronic means only. The Operational

Creditors including workmen and employees may submit the claims with proof in person, by post or by

The existing directors and managers of the Corporate Debtor are requested to ensure compliance of

provisions of Section 17 of the Insolvency and Bankruptcy Code, 2016. All existing Bankers/Financial

nstitutions maintaining the accounts of Corporate Debtor are requested to ensure compliance of Section

**FORM A** 

PUBLIC ANNOUNCEMENT

before 14.03.2020 to the Interim Resolution Professional at the address mentioned against entry No. 10.

M/s Independent TV Limited

H Block, 1st Floor, Dhirubhai Ambani Knowledge City,

Reg. No.: IBBI/IPA-002/IP-N00333/2017-18/10911

C/o M/s Synergy Insolvency Professionals LLP (IPE)

906, I-thum Business Park, Sector-62, Noida UP-201301

Formats of relevant forms are available at Web Link:

Anup Kumar

Details of Authorized Representatives: Not Applicable

https://www.ibbi.gov.in/home/downloads

Interim Resolution Professional for M/s Independent TV Limited

Reg. No.: IBBI/IPA-002/IP-N00333/2017-18/10911

734, Lawyers Chamber Block, Western Wing.

Email: cirp.independentTV@synergyipe.com

Tis Hazari Court, Delhi-110054

Email: sachanlawanalyst@gmail.com

Registrar of Companies, Mumbai

U45203MH2005PLC153294

Navi Mumbai, MH-400710

Name of Corporate Debtor

is incorporated / registered

Date of incorporation of Corporate Debtor

Authority under which Corporate Debtor

Corporate Identity No. / Limited Liability

Identification No. of Dorporate Debtor

principal office (if any) of Corporate Debtor

Address of the registered office and

Insolvency commencement date in

Estimated date of closure of insolvency

Name and Registration number of the

insolvency professional acting as Interim

Address & email of the interim resolution

professional, as registered with the board

Address and e-mail to be used for

correspondence with the Interim

Last date for submission of claims

by the Interim Resolution Professional

in a class (three names for each class)

(a) Relevant forms and

17 (1) (d) of the Code.

Date: 29.02.2020

Place: Delhi

of sub-section (6A) of section 21, ascertained

to act as authorised representative of creditors

b) Details of authorized representatives

on 26.02.2020 vide C.P. (IB) No. 3176/NCLT/MB/C-IV/2019.

Submission of false or misleading proofs of claim shall attract penalties.

Classes of creditors, if any, under clause (b) Not Applicable

Names of insolvency professionals identified Not Applicable

respect of Corporate Debtor

resolution process

Resolution Professional

Resolution Professional

All are residing at: 3-Saptrushi Society, Old Padra Road, Vadodara

In view of the Recovery Certificate issued in O.A. No. 62/2013 passed by the Hon'ble Presiding Officer, Debts Recovery Tribunal-II, Ahmedabad, an amount of ₹ 56,72,517.00 (Rupees Fifty Six Lakh Seventy Two Thousand Five Hundred Seventeen only) including interest as on 11.02.2013 and further interest from 12.02.2013 plus cost of ₹ 91,000.00 is due against you. You are hereby called upon to deposit the above sum within 15 days of the receipt

of the notice, failing which the recovery shall be made as per rules. In additions to the sum aforesaid you will be liable to pay:

 (a) Such interest and cost as in payable in terms of Recovery Certificate. (b) All costs, charges and expenses incurred in respect of the service of this notice and

other process that may be taken for recovering the amount due

Given under my hand and the seal of the Tribunal, this day 11.02.2020 (Jatin D. Gore)

Next Date : 26.03.2020

Recovery Officer-II Debts Recovery Tribunal-II, Ahmedabad

## NOTICE

Scheme Name

# 1. Declaration of dividend under Dividend option of SBI Long Term Equity Fund

SBI Mutual Fund Trustee Company Private Limited, Trustees to SBI Mutual Fund, have approved dividend under Dividend option of SBI Long Term Equity Fund as under: Face Value NAV as on

Dividend

February 27, 2020 per Unit (Rs.) (Rs.) (Rs.) SBI Long Term Regular Plan 3.40 38.7698 March 06, 2020 Equity Fund Direct Plan 4.30 10 49.4089 Pursuant to payment of dividend, the NAV of Dividend Option of

scheme / plans would fall to the extent of payout and statutory levy, if applicable. Dividend distribution is subject to availability of distributable surplus and statutory levy (if any) and may be lower, depending on the distributable surplus available on the record date. All Unit Holders / Beneficial Owners of the above scheme, whose name(s) appear in records of Registrar of SBI Mutual Fund / the statement of beneficial owners maintained by the Depositories on aforesaid record date, will be entitled to receive dividend.

Maturity of SBI Debt Fund Series C - 47 (360 Days) In terms of the Scheme Information Document, SBI Debt Fund Series C - 47 (360 Days) (the Scheme) will

Plan

mature on Thursday, March 05, 2020 and accordingly, units of the Scheme shall be suspended from trading from the respective stock exchange.

For SBI Funds Management Private Limited

Place: Mumbai

Date: February 29, 2020

Ashwani Bhatia Managing Director & CEO

Asset Management Company: SBI Funds Management Private Limited (A Joint Venture between SBI & AMUNDI) (CIN: U65990MH1992PTC065289) Trustee: SBI Mutual Fund Trustee Company Pvt. Ltd. (CIN: U65991MH2003PTC138496) Sponsor: State Bank of India Regd Office: 9th Floor, Crescenzo. C - 38 & 39, G Block, Bandra-Kurla Complex, Bandra (E), Mumbai - 400051 Tel: 91-22-61793000 • Fax: 91-22-67425687 • E-mail: partnerforlife@sbimf.com • www.sbimf.com

> Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

> > Axis Bank Ltd., 3" Floor, Gigaplex, NPC - 1, TTC Industrial Area,

SBIMF/2020/FEB/14

Authorized Signatory

Description of Property

AXIS BANK LTD. Mugalsan Road, Airoli, Navi Mumbai - 400 708. Registered Office: "Trishul", 3rd Floor, Opp. Samartheshwar Temple, Law Garden, Ellisbridge, Ahmedabad - 380006.

E-Auction Sale Notice For Sale of Immovable Property

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 read with proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) Rule, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property is mortgaged/charged to the secured creditor, the physical possession of which has been taken by the Authorised Officer of Secured Creditor will be sold on "As is where is", "As is what is" and "Whatever there is" on 20/03/2020 for recovery Rs. 3,49,46,226.87/- (Rupees Three Crores Forty Nine Lakhs Forty Six Thousand Two Hundred Twenty Six and Paise Eighty Seven Only) due to the secured creditor from 1. M/s. Abhash Enterprises 2. Mr. Abhishek Dugar 3. Servicare Labs Private Limited. The reserve price will be Rs. 2, 75, 00,000/- (Rupees Two Crores Seventy Five Lakhs Only) and the earnest money deposit Rs. 27, 50,000/- (Rupees Twenty Seven Lakhs Fifty Thousand Only). Please refer the appended auction schedule for necessary details:

> **Auction Schedule** Flat No. 12 A, admeasuring about 903 sq.ft (carpet area) situated on 2nd

Floor of Suleman Chambers Co-operative Housing Society Limited,

situated at 4, Battery Road, Apollo Bunder, Colaba, Mumbai - 400 039 in

	the name of M/s Servicare Labs Private Limited.  1. Society Dues of Rs. 7, 27,436/- payable till 31/12/2018.  2. BMC Property Tax Dues – Rs. 1,09,174/- payable till 17/05/2018		
Known Encumbrances			
Bid Incremental Amount	In the multiple of Rs.50,000/-(Rupees Fifty Thousand Only)		
	Till 19/03/2020 latest by 05:00 P.M. at Axis Bank Limited, Gigaplex, 3rd Floor, Mugalsan Road, TTC Industrial Area, Navi Mumbai – 400708 addressed to Mr. Amitkumar Detke.		
Date, Time For Opening of Bids.	On 20/03/2020 at 11.30 a.m. at Web Portal https/ www.bankeauctions.com		
Inspection of Properties	06/03/2020 & 13/03/2020, between 3.00 pm to 5.00 pm		
Cost of Tender / Bid Cum Auction Form	Rs. 250/-		
Return of EMD of Unsuccessful Bidders	Within Seven working days from the date of Auction.		
Last Date For Payment of 25% of Accepted Highest Bid For Confirmed Successful Bidder (inclusive of EMD)			

Last Date For Payment of Within 15 days from the date of bid/Sale Confirmation **Loan Details** 

Date of Demand Notice 28/02/2017

U/SEC. 13(2) of SARFAESI Act Amt. of Demand Notice U/s- Rs.3,49,46,226.87/- (Rupees Three Crores Forty Nine Lakhs Forty Six

Date of Physical Possession 05/03/2018 **Publication Date of** 07/03/2018

**Possession Notice** 

Balance 75% of Highest Bid

For detailed terms and conditions of the sale, please refer to the link provided in the secured creditor's website i.e. https://www.axisbank.com/auction-retail. For any other assistance, the intending bidders may contact Mr. Amitkumar Detke (8879778215) & Ravindra More (7498883965) Authorized officer of the Bank during office hours from 9:30 a.m. to 4:00 p.m.

13(2) of SARFAESIAct (in Rs.) | Thousand Two Hundred Twenty Six and Paise Eighty Seven Only)

This Notice should be considered as 15 Days' Notice to the Borrowers under Rule 8(6) of the Security Interest (Enforcement) rule, 2002.

Date: 01/03/2020 Place: Airoli, Navi Mumbai

(Under Regulation 6 of the Insolvency and Bankruptcy Board of India (Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016) FOR THE ATTENTION OF THE CREDITORS OF TOPWORTH STEELS AND POWER PRIVATE LIMITED

8	RELEVA	NT PARTICULARS		
1 Name of the Corporate Debtor		Topworth Steels and Power Private Limited		
2.	Date of incorporation of corporate debtor	18th May 2004		
3.	Authority under which corporate debtor is incorporated / registered	Companies Act, 1956		
4.	Corporate identity number/ limited liability identification number of corporate debtor	U51420MH2004PTC146381		
5.	Address of the registered office and principal office (if any) of corporate debtor	308, 3rd floor Ceejay House Dr. A. B. Road, Worl Mumbai, Maharashtra - 400018		
6.	Insolvency commencement date in respect of corporate debtor	February 28, 2020 (NCLT Order dated 29.01.2020)		
7.	Estimated date of closure of insolvency resolution process	August 26, 2020		
8.	Name and registration number of the insolvency professional acting as interim resolution professional			
9.	Address and e-mail of the interim resolution professional, as registered with the Board	1101, Dalamal Tower, Free Press Journal Marg Nariman Point, Mumbai 400021, Email: dushyant.dave@decoderesolvency.com		
10.	Address and e-mail to be used for correspondence with the interim resolution professional	1101, Dalamal Tower, Free Press Journal Marg, Narimal Point, Mumbai 400021. Email: topworth@decoderesolvency.com		
11.	Last date for submission of claims	March 13, 2020		
12.	Classes of creditors, if any, under clause (b) of sub-section (6A) of section 21, ascertained by the interim resolution professional	Not Available		
13.	Names of Insolvency Professionals identified to act as Authorised Representative of creditors in a class (Three names for each class)	Not Available		
14.	(a) Relevant Forms and (b) Details of authorized representatives are available at:	Web link: ibbi.gov.in/home/downloads Physical Address: NA		

of a corporate insolvency resolution process of the Topworth Steels and Power Private Limited on January 29, 2020. The creditors of Topworth Steels and Power Private Limited, are hereby called upon to submit

the address mentioned against entry No. 10. The financial creditors shall submit their claims with proof by electronic means only. All other creditors may submit the claims with proof in person, by post or by electronic means. A financial creditor belonging to a class, as listed against the entry No. 12, shall indicate its choice of authorised representative from among the three insolvency professionals listed

their claims with proof on or before March 13, 2020 to the interim resolution professional at

against entry No.13 to act as authorised representative of the class NA in Form CA Submission of false or misleading proofs of claim shall attract penalties. Date: 29.02.2020 **Dushyant C Dave** Interim Resolution Professional

FCS - 7805

GMR Infrastructure Limited Regd. Office: Naman Centre, 7th Floor, Opp. Dena Bank, Plot No.C-31, G Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai- 400051 | Ph: +912242028000 | Fax: +912242028004 Email: Gil.Cosecy@gmrgroup.in Website: www.gmrgroup.in CIN: L45203MH1996PLC281138

Members are hereby informed that pursuant to Section 110 of Companies Act, 2013 read with Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014, including any statutory modification or re-enactment thereof for the time being in force) and the Securities Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (LODR) the Company has completed the dispatch of Postal Ballot Notice on February 29, 2020 along with Postal Ballo Form, through electronic mail to the Members whose e-mail IDs are registered in the Depository records on February 24, 2020 i.e. cut-off date and through physica mode along with a self- addressed postage prepaid Business Reply Envelope to the other Members (i.e. whose e-mail IDs are not registered), whose names appear in the register of members as on February 24, 2020, for seeking approval of Members by way Special Resolutions for the business set out in the Notice dated February 29,

NOTICE

The Company has engaged the services of Kfin Technologies Private Limited (Kfintech), Registrar & Share Transfer Agent, for providing e-voting facility to all the Shareholders of the Company. Shareholders are requested to note that the voting both through physical and electronic mode shall commence from Sunday, March 2020 at 9.00 a.m. IST and shall end on Monday, March 30, 2020 at 5.00. p.m. IST Duly completed Postal Ballot Form should reach the Scrutinizer on or before the close of working hours of March 30, 2020 (i.e., 5:00 p.m. IST). Postal Ballot Forms received after working hours (i.e., 5:00 p.m. IST) of this date will be treated strictly as if the reply from the Shareholder has not been received and further, person who is not a member as on the cut-off date should treat this Notice for information

purpose only. Shareholders who have not received Postal Ballot Form may either

or apply to the Company / Registrar (i.e., Kfin Technologies Private Limited., Unit

GMR Infrastructure Limited, Selenium Tower B, Plot 31-32, Gachibowli, Financial

Voting rights shall be reckoned on the paid-up value of equity shares registered in

the name of members as on February 24, 2020.

(i) https://evoting.karvy.com; (ii) www.gmrgroup.in

Date: 29.02.2020

District, Nanakramguda, Hyderabad - 500032), to obtain the duplicate thereof. For any grievances / queries relating to voting by Postal Ballot or by electronic means, Shareholders are requested to contact Mr. Ramdas G, Kfin Technologies Private Limited. Phone: 18003454001; Email: einward.ris@kfintech.com The result of the Postal Ballot (including e - voting) will be declared along with the Scrutinizer's Report, on or before Wednesday, April 1, 2020 by 4.00 p.m. at registered office of the Company i.e., Naman Centre, 7th Floor, Opp. Dena Bank Plot No.C-31, G Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai- 400051 and will be hosted on the website of the Company at www.gmrgroup.in and on the website of Kfintech at https://evoting.karvy.com and will also be displayed on the notice board of the Company at its Registered Office and Corporate Office, immediately after the declaration of the result by the Chairman or a person

www.nseindia.com on which the equity shares having face value of Re.1/- each of By order of the Board For GMR Infrastructure Limited Place: New Delhi T. Venkat Ramana

Company Secretary & Compliance Officer

GMR GROUP - GIL / 151 / PREM ASSOCIATES

authorised by him in writing and after the results are communicated to BSE Limited

at www.bseindia.com, National Stock Exchange of India Limited at

WELSPUN ENTERPRISES LIMITED CIN: L45201GJ1994PLC023920 Regd. Office: Welspun City, Village Versamedi, Taluka Anjar, District Kutch, Gujarat-370 110. Tel.: + 91 2836 662222; Fax: + 91 2836 279010 Corporate Office: Welspun House, Kamala City, Senapati Bapat Marg, Lower Parel

Website: www.welspunenterprises.com; Email: companysecretary\_wel@welspun.com POSTAL BALLOT NOTICE

(West), Mumbai-400 013. **Tel.:** + 91 22 6613 6000; **Fax:** + 91 22 2490 8020

NOTICE is hereby given that pursuant to Section 110 of the Companies Act, 2013 read with Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014, (including any statutory modification(s) or re-enactment(s) thereof for the time being in force), SEB (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and such other applicable laws and regulations, the approval of members of Welspun Enterprises Limited (the "Company") is being sought by way of ordinary resolution for the business set out in the Notice dated February 12, 2020.

Γhe members are hereby informed that: The Company has completed the dispatch of Notice of Postal Ballot on February 29, 2020 along with Explanatory Statement and Postal Ballot Form to all the members whose names appear in the Register of Members/ Record of National Securities Depository Limited (NSDL) and Central Depository Services (India) Limited (CDSL) as on February 21, 2020 i.e. the cut-off date.

2. The voting through postal ballot and e-voting will commence on Monday, March 02, 2020 (9.00 a.m.) and will end on Tuesday, March 31, 2020 (5.00 p.m.). Remote e-voting module

will be disabled on Tuesday, March 31, 2020 (5.00 p.m.) and postal ballot form received from the members to the Scrutinizer beyond Tuesday, March 31, 2020 (5.00 p.m.) will be strictly treated as if reply from such member has not been received. The voting rights of members shall be in proportion to their share in the paid-up equity

share capital of the Company as on the cut-off date of February 21, 2020. A person who is not a Member on the cut-off date shall treat this notice for information purposes only. Members can opt for only one mode of voting i.e. either by physical postal ballot or e-voting. In case a member has voted through e-voting as well as postal ballot, the vote casted through e-voting would be considered and the vote casted through physical

postal ballot shall be treated as invalid. Members who have not received the Postal Ballot Notice and Postal Ballot Form may apply to the Company or its Registrar and Transfer Agent and obtain a duplicate thereof. . The Board of Directors of the Company has appointed Mr. Mihen Halani, Company Secretary, (Certificate of Practice No.12015) Proprietor of M/s. Mihen Halani & Associates.,

voting and remote e-voting process.

Notice of the Postal Ballot, Postal Ballot Form and procedure for voting (including remote e-voting) is available on the Company's website: www.welspunenterprises.com and on the website of National Securities Depository Limited: www.evoting.nsdl.com. . The results of the voting by Postal Ballot (along with the Scrutinizer's report) will be announced by the Chairman and in his absence any Director of the Company or the Company Secretary on or before April 01, 2020, at the Corporate office of the Company and will also be displayed on the website of the Company www.welspunenterprises.com,

Practicing Company Secretaries, Mumbai as Scrutinizer to scrutinize the Postal ballot

Share Transfer Agent. Members may contact the following for any grievance or query connected with the voting by Postal Ballot between 10:00 a.m. and 6:00 p.m. on any working day: For gueries related to Postal Ballot: For queries related to e-voting: Company Secretary, Ms. Pallavi Mhatre,

besides being communicated to the Stock Exchanges, Depositories and Registrar &

Welspun Enterprises Limited Assistant Manager, NSDL Email: evoting@nsdl.co.in, companysecretary\_wel@welspun.com pallavid@nsdl.co.in Phone: 0222499 4600/ 1800-222-990 Phone:+91 (022) 66136000 For Welspun Enterprises Limited

**Company Secretary** February 29, 2020

Priya Pakhare

Mumbai - 400021 INDI/

1101 Dalamal Towers, Nariman Poin

IBBI Reg. No: IBBI/IPA-003/IP-N00061/2017-2018/10502

#### વેલસ્પન એંટરપ્રાઈઝીસ લિમિટેડ

CIN: L45201GJ1994PLC023920

રિજ. ઑફિસ : વેહસ્પન હિટી, ગામ-વરમિડી, તાલુકો-અંજાર, જિલ્લો-કર્સ્થક, ગુજરાત-૩૯૦ ૧૧૦, ટેલી.: +૯૧ સ્ટકદ્ દદ્દસ્ચરમ, કંકસ: +૯૧ સ્ટકદ્ સ્હદબવ કોર્પોસ્ટ ઑફિસ : વેલસ્ન હાઉસ, કમલા હિટી, સેનાપતી બાપટ માર્ગ, લોઅર પરેલ (વેસ્ટ), મુંબઇ - ૪૦૦ ૦૧૩. ટેલી.: +૯૧ ૨૨ દૃદ્૧૩ દૃ૦૦૦; કેક્સ: +૯૧ ૨૨ ૨૪૮૦ ૮૦૨૦ niida : www.welspunenterprises.com; dમેલ : companysecretary\_wel@welspun.com

#### પોસ્ટલ બૅલટ સૂચના

ા સાથે, ધ કંપનીઝ ઍક્ટ ૨૦૧૩ ની કલમ ૧૧૦ ના અનુસરે વંચાણ લેતા દા કંપનીઝ (મૅનેજમેન્ટ અ એંડ્રમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૧૦૧૪ (કોઇપણ કાયદાકીય સુધારા અથવા કરિથી અમાલમા અવતા કલમે સહિત) નિયમ ૧૧, સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ અને કિસક્લોઝર રીક્વાયરમેન્ટ્સ) દેગ્યુલેશન્સ, ૨૦૧૫ અને અન્ય લાગુ કાયદા અને જોગવાઇઓ ના અનુપાલમાં, વેલસ્પન ઇટરમાઈપ્રીસ લિમિટેડ (ધ ''કંપની'') ના સભ્યોને, તારીખ ૧૨મી ફેબ્રુવારી, ૨૦૨૦ ની નોટિસમાં નિર્દિષ્ટ કરવામાં આવેલા થવસાયો માટે ઓડીનરી ઠરાવો દ્વારા કંપની માન્યતા/સ્વીફૃતિ માગી રહી છે. આ સાથૈ સભ્યોને સુચિત કરવામાં આવે છે કે :

જેમનાં નામો, ૨૧મો કેબુવારી, ૨૦૧૦ (એટલે કે કટ-ઑક કેટ) ના રોજ મેમ્બરોના રજિસ્ટર/નેંશનલ સીક્યુરિટીઝ કિપોઝિટરી લિમિટેક (એનએસકીએલ) તથા સેન્ટ્રલ કિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેક (સીડીએસએલ) ના રોકૉર્ડ્સ પર અસ્તિત્પમાં ક્ષેય તે બધા સબ્યોને કંપનીએ સ્તમી કેબ્રુવારી, સ્વસ્વ ના રોજ પોસ્ટલ બેંલટની નોટિસ (વિગતવાર નિવેદન અને પોસ્ટલ બેંલેટ ફોર્મ સાથે)પાઠવવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે.

પોસ્ટલ બેલટ અને ઇ-વોર્ટિંગ મારફત વોર્ટિંગનો પ્રારંભ સોમવાર, ૦૨મી માર્ચ, ૨૦૨૦ ના રોજથી (સવારે ૯:૦૦ વાગ્યે) શરૂ થશે અને મંગલવાર, ૩૧મી માર્ચ, ૨૦૨૦ ના ( સાંજે ૫.૦૦) વાગ્યે પૂર્ણ (સ્વાન ૧૯૦૦ નાન) રાફ ધર્મ અંગ નગાવાન, ૩૧૧ નાત, ૧૯૨૦ માં (૧૯૧૧ ૧.૦૦) વાન્ય યુદ્ધ શેરો, રીમોટ ઇ—વોટિંગ મોડશૂલ મંગલવાર, ૩૧મી માર્ચ, ૨૦૨૦ ( સાંજે ૫.૦૦) પછી સ્કૃટિનાઇક્ટરને બનાવી દેવામાં આવશે અને મંગલવાર, ૩૧મી માર્ચ, ૨૦૨૦ ( સાંજે ૫.૦૦) પછી સ્કૃટિનાઇક્ટરને મળેલાં કોઈપણ પોસ્ટલ બૅલટ ફૉર્મ અંગે, આવા સભ્ય તરફથી પ્રત્યુત્તર નથી મળ્યો, એ રીતે કડકપણે ગણવામાં આવશે.

કટ ઑફ તારીખ સ્થમી ફેબ્રુવારી, સ્૦૨૦ના રોજ હોય તે રીતે કંપનીની ઇક્વિટી શેર મૂકીમાં તેમ પેંડ—અપ શેર ફોય, તેના પ્રમાણમાં સભ્યોના મતદાન અધિકારો રફેશે. કોઇ વ્યક્તી જે કર્ટ - ઑફ કેટ પર સભ્ય નથી, તે ફક્ત આ સુચનાના હેતુ માટે સુચનાનો ઉપયોગ કરશે.

સભ્યો મતદાન કરવાની કેવળ એક જ પદ્ધતિનો વિકલ્પ અપનાવી શકે છે, એટલે કે, ફિઝિકલ્ પોસ્ટલ બેંલટ ક્ષણ મતદાન અથવા ઇ–વોર્ટિંગ મારકત મતદાન. એવા કિસ્સામાં કે જેમાં, કોઈ સભ્યે ઈ-વોર્ટિંગ ઉપરાંત પોસ્ટલ બેલર દ્વારા મતદાન કરેલું કશે, તો તેમાં ઈ-વોર્ટિંગ દ્વારા કરેલું મતદાન માન્ય ગણવામાં આવશે અને ફિઝિકલ પોસ્ટલ બેલટ દ્વારા કરવામાં આવેલું મતદાન રદબાતલ

જે સભ્યોને પોસ્ટલ બેંલટ નોટિસ અને પોસ્ટલ બેંલટ કોર્મ મળ્યા ન હોય તેઓ કંપનીને અથવા તેન રજિસ્ટ્રાર અને ટ્રાન્સકર એજન્ટને અરજી કરી શકે છે અને તેની કુપ્લીકેટ મેળવી શકે છે.

કંપનીના બોર્ડ ઑફ કાયરેક્ટરોએ પોસ્ટલ બૅલટ વોર્ટિંગ અને રીમોટ ઈ-વોર્ટિંગ પ્રક્રિયાની ચોકસા કરવા માટે શ્રી. મિઠેન હલાની, પ્રેકિટરિંગ કંપની રોકેટરી, (પ્રેકિટરિંગ ન. ૧૨૦૧૫ નુ પ્રમાણપત્ર) મેરાર્રાના પ્રોપ્રાઇટર મિઠેન હલાની અને એસોસિએટસ, પ્રેકિટરિંગ કંપની સેફેટરીઝ, મુંબઇ, પોસ્ટલ બેંલટ મતદાન અને રિમોટ ઇ-વોર્ટિંગ પ્રક્રિયાની ચકાસણી કરવા માટે સ્ફટિનાઇઝર તરીકે

પોસ્ટલ બૅલટ, પોસ્ટલ બૅલટ ફૉર્મ અને વોટિંગની પ્રક્રિયા (રીમોટ ઇ-વોર્ટિંગ સહિત) અંગેની નોટ્સ કેપાનીની વેબસાઇટ, www.welspunenterprises.com પર અને / મેંચનલ સીક્યુરિટીઝ કિપાનિક ઉભાઇટન મુજબાઇન સ્ટેક્સિટિઝન કિપાનિકટરી લિમિટેડની વેબસાઇટ <u>www.evoting.nsdl.com</u> પર ઉપલબ્ધ છે.

પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનના પરિસામો (સ્કુટિનાઇઝર્સ અદેવાલ સાથે) ચેરમેન દ્વારા જાહેર કરવામાં આવશે અને તેની ગૈરહાજરીમાં કંપનીના કોઈ ડિરેક્ટર અથવા કંપની સવિવ ૦૧ એપ્રિલ, २०२० ના રોજ અથવા તે પહેલાં, કંપનીની કોર્પારેટ ઓફિસ પર અને સ્ટોક એક્સવેંજ, ડિપોઝિટરીઝ અને રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટને પણ જાણ કર્યો ઉપરાંત, કંપનીની વેબસાઇટ

www.welspunenterprises.com, પર પણ પ્રદર્શિત થશે. પોસ્ટલ બેંલટ દ્વારા મતદાન સંબંધિત કોઈપણ ફરિયાદ અથવા પૂછપરછ માટે સભ્યો કામકાજન કોઈપણ દિવસે સવારે ૧૦:૦૦ અને સાંજે ૬:૦૦ વચ્ચે નિમ્નલિખિતોનો સંપર્ક કરી શકે છે:

પોસ્ટલ બૅલટ સંબંધિત પૂછપરછો માટે : કંપની સેંકેટરી. વેલસ્પન એન્ટરપ્રાઈઝીસ લિમિટેક ઈ-મેલઃ companysecretary\_wel@welspun.com

slor: 0२२ 55935000

ઈ-વોટિંગ સંબંધિત પૂછપરછો માટે : . परसवी महात्रे એસિસ્ટન્ટ મેંનેજર, એનએસડીએલ ઈ-મેલઃ evoting@nsdl.co.in, pallavid@nsdl.co.in slor : ০২২ ২४৫৫ ४५०० / 9200-888-660

વેલસ્પન એન્ટસ્પાઈઝીસ લિમિટેક વર્ત

મુંબર્ઇ, ફેબ્રુવારી ૨૯, ૨૦૨૦



**પેસેન્જરો રખક્યા…** શનિવારે દાદરથી આવતી અને ભુજ જતી પેસેન્જર ટ્રેનને આડેસર થોભાવી દેવામાં આવી હતી. જાણવા મળતી વિગતો મુજબ આડેસર અને સામખિયાળી વચ્ચે રેલવે ટ્રેકનું કામ ચાલુ હોતાં આ ટ્રેન આડેસર થોભાવી દેવામાં આવી હતી. આડેસર ટ્રેન થોભી જતાં ટ્રેનના મુસાફરો અટવાઈ પડ્યા હતા અને રિક્ષાઓ અને પેસેન્જર વાહનોમાં આ ટ્રેનના મુસાફરો આડેસર બસ સ્ટેશન પહોંચી પોતપોતાના વતન પહોંચ્યા હતા. જો કે રેલવે તરફથી આ મુસાફરો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી, પરંતુ આ દાદર-ભુજ પેસેન્જર ટ્રેનના ડ્રાઈવરો, ટી.સી. વગેરે જેવા ૧૪ જેટલા કર્મચારીને ગાંધીધામ લઈ જવા રેલવે તંત્ર દ્વારા સ્પેશિયલ ગાડી આડેસર રેલવે સ્ટેશન મોક્લવામાં આવી હતી. હજુ બે દિવસ પેસેન્જર ટ્રેન આ સામખિયાળી આડેસર વચ્ચે નહીં ચાલે. તસવીરોમાં આડેસર રેલવે સ્ટેશને થોભેલી દાદર-ભુજ ટ્રેન તેમજ આ ટ્રેનના મુસાફરો આડેસર બસ સ્ટેશને બસની રાહ જોઈને ઊભેલા દેખાય છે. **(તસવીર : ખેંગાર પરમાર)** 

# રાપરમાં સ્ત્રીધનને ઓળવી જવા વિશે સાસરિયા સામે ફરિયાદ

ગાંધીધામ, તા. ૨૯ : રાપરની પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકનારા સાસરિયાઓ સ્ત્રીધન પણ ઓળવી ગયા હોવાની ફરિયાદ રાપર પોલીસ

સુધારો

તા. ૨૯-૨-૨૦૨૦ શનિવારના

કરછમિત્રના પાના નં. ૫ .૫૨ 'જોઈએ

છે' શેઠ.ડી.એન. ટ્રસ્ટ પ્રા. શાળા

વીડી હાઈ-ભુજવાળી જાહેર ખબરમાં

शिक्षs-৭ (B.P.ED./C.P.ED.)

વ્યાયામના બદલે સુધારીને શિક્ષક-૧

(D.P.ED/C.P.ED.) વ્યાચામ

ચોપડે નોંધાઈ છે.

સામે છેતરપિંડી સહિતની ક્લમો પોલીસના સત્તાવાર સાધનો તળે ફરિયાદ નોંધાવી છે. પાસેથી મળતી વિગતો મુજબ આ આરોપીઓ ફરિયાદીની દીકરી

## આરોપીઓ સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી

બનાવ સંદર્ભે ફરિયાદી સૂર્યશંકર જાગૃતિને ગત તા. ૨૦. ૪. તાલુકાના બેલાના અને હાલ સુરત ખાતે રહેતા આરોપીઓ હસમુખલાલ શાંતિલાલ વ્યાસ અને ચિંતન હસમુખલાલ વ્યાસ

પશ્ચિમ રેલવે <u>નોન એસી વાહન ભાડે રાખવા</u>

ઓપરેશન્સ વિભાગ, ડિવિઝનલ ઓફિસ, અમદાવાદ. ટેન્ડર નોટીસ નં. : (1) T.590/HV/02OptgOfficersADI/e-Tender/ ADI/35/2019-2021-Retender તારીખ 25.02.2020 ≈4-1 (2) T.590/HV/ATM-GIM/e-Tender/ADI/36/ 2019-2021-Retender ชนใบ : 25.02.2020 ล่. s. (ii ઘર્ણન ઈ-ટેન્ડર સં. (1) : ટેન્ડર નં. DRM-O-ADI 35-HV-02Optg Officers-ADI-2019-2021-Retender (ii) કામનુ નામ : 2 નોન એસી વાહન ભો રસ્વાલાના (મ) કરાવું માત્ર 12 માત્ર વહાર વહાર પછ વ્યવસાયક તથા એએએએ (એમ) -એડીઆઈ માટે એટલે કે 2 ઓપલેઈંગ ઓક્સિસ્સની અનુકળતા માટે વાકનોના 12 કલાકના ઉપલોશ્યોન્ટ માટે કચેરી હતુ માટે (એટલે કે મહિન્દ્રા રેપુર્વી 300 અથવા ટાટા નેશોન અથવા કંઈ ઈક્ષે સ્પોર્ટ્સ અથવા અહીંગ અથવા તથા જ મેઈકનું પાર વહારના ભોડ ગવવા અંદ્રાના બવાના વધા જ વેઠાનું અંદ પાર / વાંકર ૧૫૧ ૧૫૦૧ . (III) કામની અંદ્રાક્ષિત કિંમત ₹ : ₹ 21,54,280,80 અમલી નિયમ અનુસાર બધા વેરા, લેવિસ તથા લાગુ પડતા જીએસટી સહિત. (IV) અર્જેસ્ટ મની ડિપોઝીટ ₹: ₹ 43,100/- સં. ક. (I) વાર્ફેન ઈ-ેન્દ્ર સં (2) જેન્દ્ર નં : DRM-O-ADI-36-HV-ATM-GIM-2019-2021-Retender (ii) 5(4-1-12) 1 નોન એસી વાહન ભોડરાબવું (એટલે કે ગાંધી એટીએમ-ગાંધીયામની અનુકુળતા માટે વાહનોના 12 કલાકના ઉપ્લોશ્યેમ્ટ માટેકમેરી હેતુ માટે (એટલેકે મહિન્દ્રા ટીપુથી 300 અથવા ટાટા નેક્ષોન અથવા કોઈ ઈક્ષે સ્પોર્ટસ અથવા અર્ટીગા કામની અંદાજિત કિમત ₹ : ₹ 10.92,456.96 અમલી નેયમ અનુસાર બધા વેરા, લેવિસ તથા લાગુ પડતા જીએસટી તહિત. (**iv) અનેસ્ટ મની ડિપોઝીટ** ૨: ૨ 21,900/-ઉપરોક્ત બધા ટેન્ડર માટે (v) ઈ-ટેન્ડર જમા

કરાવવાની અને ખુલવાની તારીખ અને સમયઃ તા. 26.03.2020ના 15.00 કલાકથી મોત્ર નહીં તે રીતે

કચેરીના કામના કલાક/દિવસ દરમિયાન નિયત કોર્મમાં જયા કરાવવાના રહેશે અને તે જ દિવસે 15.30 કલો

ખોલવામાં આવશે. (v) વેબસાઇટ વિવરણ અને કચેરીનું સરનામું કચાંથી ટેન્ડર દસ્તાવેજ ખરીદી શકાશે અને નોટીસ બોર્ડનું સ્થાન કચાંથી ટેન્ડરની ચંચ્ચ દિલ્લો

નોટીસ બોર્ડનું સ્થાન જ્યાંથી ટેન્ડરની સંપૂર્ણ વિગતો જોઈ શકાશેઃ રેલવેની આઈઆરઈપીએસ વેબસાઈટ:

http://www.ireps.gov.in ડિવિઝનલ રેલવે મેનેજ (ઓપ્ટેશન્સ)ની કચેરી, ડીઆરએમની કચેરી,

પહેલો માળ, ઓપરેટિંગ વિભાગ, ચામુંડા માતાના મંદિર પાસે, ન્યુ સ્વદેશી મિલની સામે, નરોડા રોડ, પોસ્ટ: ક્ષેત્રપુર હોંગ

અમદાવાદ-382345 (ગુજરાત). 398

લક્ષ્મીશંકર ગોરે મૂળ રાપર ૨૦૧૮ના પિયર મૂકી ગયા હતા. આરોપીઓએ ફરિયાદીની દીકરી સાથે છૂટાછેડા માગ્યા

ફરિયાદીએ જાગૃતિને સ્ત્રીધનમાં આપેલા સોના-

વપરાશની વસ્તુઓનો સરસામાન પરત આપવા સાહેદો દ્વારા અને રૂબરૂમાં પણ કહ્યું હતું. આરોપીઓએ સ્ત્રીધન આપી દેવાનું કહ્યું હતું, પરંતુ અંગત સ્વાર્થ ખાતર સ્ત્રીધન પચાવી પાડવાના ઈરાદે આજસુધી ન આપી વિશ્વાસઘાત કર્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વધુ તપાસ રાપર પી.એસ.આઈ એચ. એમ. પટેલ ચલાવી રહ્યા છે.

ચાંદીના દાગીના અને ઘર

### અહેર હરાજી

ગોળ કેરી (ગુજરાતી)

શુભ મંગલ જ્યાદા સાવધાન

### શ્રી બિદડા પ્રાથમિક શાળા

બિદડા, તા. માંડવી-કચ્છ.

સૂરમંદિર સિનેપ્લેક્સ–ભુજ

આ રવિવાર પૂરતા સૂરમંદિરમાં મનોરંજનનો ટાઈમ નોંધી લેશો

સમય

10.20 AM

12.40 PM

03.00 PM

05.20 PM

07.35 PM

09.55 PM

പ്പ്പ

થપ્પડ

થખડ

ભૂત

એડવાન્સ બુકિંગ સવારે ૧૦થી ૧૦ બોક્સ ઓફિસ પર ચાલુ છે.: M. 99097 44944 💻 Pay 🗂 ઓનલાઈન ટિક્ટિટ બુકિંગ પે-ટીએમ પર ચાલુ છે.

શાળાનો જર્જરિત ઓરડો એક તોડી તેનો કાટમાળ લઈ જમીન સમથળ કરી આપવાની જાહેર હરાજી તા. ૦७/૦૩/૨૦૨૦ને શનિવારના સમય ૧૦.૦૦ કલાકે શ્રી બિદડા પ્રા શાળામાં રાખેલ છે. હરાજી અંગેની શરતો હરાજી પહેલા વાંચી સંભળાવવામાં આવશે હરાજીમાં ભાગ લેનારે રૂા. ૫૦૦ ડિપોઝિટ જમા કરાવવાની રહેશે.

સભ્ય સચિવ S.M.C. અધ્યક્ષશ્રી જુસબભાઈ સાટી ઠાકરશીભાઈ કે. ધોરિયા મો. ૭૮૭૪૬ ૨૯૧૯૯ eeeug coeeu

#### **MODERN CINEMA-BHUJ** રવિવારનું બેસ્ટ મનોરંજન પરિવાર સાથે

જોવાલાચક ગુજરાતી મૂવી 'ગોળકેરી' Lowest Ticket Rates in BHUJ / ONLY FROM 70

Tele Booking મુપરહિટ ગુજરાતી ફિલ્મ 'ગોળ કેરી' 99783 96526 આપની દિકિટ PayTM અને મેળવો કેશ બેર

> શો ટાઈમ શો ટાઈમ 98.80

03.84 00.00 06.80 −ભુજ (એરકલ્ડિશન) D I G I T A L

(70) ലി D ( DOLBY

ઓનલાઈન

Book My Showથી

બુક કરીને

ટિક્ટિના સૌથી

ઓછા દર ભુજમાં

# ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ.

બાંધકામ વિભાગ, અંજાર. વીજપુરવઠો બંધ રહેવા બાબતની જાહેરાત

આથી માનવંતા વીજગાઢકોને જણાવવાનું કે અમારે દૃદૃ કે.વી. લીલો દેશલપર લાઈનના વાયર નાખવાની કામગીરી કરવાની હોવાથી દૃદૃ કે.વી. મુંદરા, દૃદૃ કે.વી. ભુજપુર અને દૃદ્દ કે.વી. બરાચા સબ સ્ટેશનમાંથી નીકળતા નીચે વાડી વિસ્તારોને તા. 03-03-૨૦૨૦ના રોજ સવારના ૦૮.૦૦થી સાંજના ૧૯.૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહીં.

અ.નં.	તારીખ	સમય	ફીડરનું નામ	ગામના નામ
q	di. 03-03-2020	સવારના ૦૮.૦૦થી સાંજના ૧૯.૦૦ સુધી	દ્દ કે.વી. મુંદરા અંગ સ્ટેશનમાંથી નીકળતા (૧) ૧૧ કે.વી. ગુંદાલા (એ.જુ.) (૨) ૧૧ કે.વી. સમાથોથા (એ.જુ.) (૪) ૧૧ કે.વી. ભીડભંજન (એ.જુ.) (૪) ૧૧ કે.વી. હેશલપુર (એ.જુ.) (૫) ૧૧ કે.વી. હેશલપુર (એ.જુ.) (૦) ૧૧ કે.વી. લાભાગ્યર (એ.જુ.) (૦) ૧૧ કે.વી. ભાગ્યર (એ.જુ.) (૧) ૧૧ કે.વી. ભાગ્યર (એ.જુ.) (૧) ૧૧ કે.વી. ભાગ્યત્ર (એ.જુ.) (૧) ૧૧ કે.વી. અંગ્યત્ર (એ.જુ.) (૪) ૧૧ કે.વી. અંગ્યત્ર (એ.જુ.) (૪) ૧૧ કે.વી. અંગ્યત્ર (એ.જુ.) (૦) ૧૧ કે.વી. અંગ્યત્ર (એ.જુ.) (૦) ૧૧ કે.વી. અંગ્યત્ર (એ.જુ.) (૧) ૧૧ કે.વી. પ્રાચાય (એ.જુ.)	દર્શવિલ ફીડરોને લગતા તમામ ગામ અને આયુખાયુનો વાડીવિસ્તાર

નિર્ધારિત કામ વહેલું પૂરું થતાં બીજી કોઈપણ જાતની જાહેરાત આપ્યા સિવાચ પુનઃ વીજપુરવઠો રથાપિત કરવામાં આવશે, તેની નોંધ લેવા વિનંતી. વીજળી બચાવો સ્વ તથા રાષ્ટ્રના હિતાર્થે' કાર્ચપાલક ઈજનેર (બાંધકામ), ગેટકો, અંજાર

દર બુધવારે કોઈ પણ ટિકિટના દર કક્ત

31. 100 (Excluding Sofa)

12.45 PM

03.45 PM

06.45 PM

09.45 PM

#### <u> મુખ્યામાં કર્ના સિનેપ્લેક્ષ – અંજાર [FUN CINEMAS]</u> **Best Entertainment of Sunday @ MODERN CINEPLEX ANJAR** ગુજરાતી પારિવારિક મનોરંજન







શો **ગોળ કેરી** (ગુજરાતી) : 10.30AM, 01.30PM, 03.00PM, 05.20PM, 07.40PM, 10.00PM ટાઈમ **ലയട**: 11.00AM, 04.00PM, 07.00PM, 09.45PM The Invisible Man: 12.45PM

માપની ટિકિટ ઓનલાઈન PayTM અને Book My Showથી બુક કરી શકો છો. Tele Booking 99782 61100 MADERN मोडर्न सिनेप्लेझ (FUNCINEMAS)

નિયામક, અન્ન અને નાગરિક પુરવઠા ક્યેરી, ગુજરાત સરકાર રાજ્યના રેશનકાર્ડ ધારકો જોગ અગત્થની સૂચના . રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ના લાભાર્થીઓને માર્ચ-૨૦૨૦ માસ દરમ્યાન આધારકાર્ડ નંબરથી ઓળખ પ્રસ્થાપિત કરીને રાજ્યની કોઇ

용비	કેટેગરી	वस्तु	મળવાપાત્ર જથ્થો (કિ.ગ્રા.)	)	ભાવ પ્રતિ કિ.ગ્રા. રૂા. પૈસા
q	અંત્યોદય કુટુંબો	ଷଞ	813కిగిన	84.000	9.00
		ચોખા	<u> පාර්</u> ව්ර	90.000	3.00
5	અગ્રતા ધરાવતા કુટુંબો	ยชี	વ્યક્તિદીઠ	3.400	9.00
		ચોખા	વ્યક્તિદીઠ	9.400	3.00
3	બીપીએલ	чis	વ્યક્તિદીઠ	0.340	99.00
Я	અંત્યોદય	wis	3 વ્યક્તિ સુધી કાર્ડદીઠ	9.000	94.00
			3થી વધુ વ્યક્તિદીઠ	0.340	94.00
ч	અંત્યોદય અને બીપીએલ	આચોડાઈઝ	દ્દ વ્યક્તિ સુધી કાર્ડદીઠ	9.000	9.00
		મીહું	દૃથી વધુ વ્યક્તિ માટે કાર્ડદીઠ	9.000	9.00
2	કેરોસીન પાત્રતા ધરાવતા બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકો	કેરોસીન			સ્થાનિક રીતે કલેકટરશ્રીએ નક્કી કરેલ રાહતદરે (પ્રતિ લિટ

પણ વાજબી ભાવની દકાન પરથી આવશ્યક ચીજવસ્તઓનો ઠરાવેલ જથ્થો નીચે મુજબના ભાવથી મળવાપાત્ર થાય છે.

વાજબી ભાવની દુકાન પરથી રેશનિંગની શીજવસ્તુઓનો જથ્થો મેળવવા માટે આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર તથા ફોન નંબરની નોંધણી કરાવવી આવશ્ચક છે જેની નોંધ લેવી. આધાર નંબર ન ઢોચ તો આધાર નોંધણી નંબર (EID No) રજૂ કરવાનો રહેશે. અન્થથા જો આધાર નોંધણી માટે અરજી કરી ઢોચ તો પ્રવર્તમાન

નિયમોનુસાર ૧૩ વૈકલ્પિક પુરાવા પૈકી કોઈ એક પુરાવો રજૂ કરી રેશનકાર્ડદારકો મળવાપાત્ર આવશ્ચક ચીજવસ્તુ મેળવી શકે છે. રાજ્યાની તમામ વાજળી ભાવની દુકાનો પર કેશલેસ પેમેન્ટ માટે AEPS (Aadhar Enable Payment System)ની સેવાઓ ઉપલબ્ધ છે, જેન વધુમાં વધુ લાભ લેવા વિનંતી છે.

પુરવઠા વિષયક માઢિતી પારદર્શિતા પોર્ટલ dcs-dof.gujarat.gov.in તથા http://ipds.gujarat.gov.in પરથી મેળવી શકે છે. જાન્યુઆરી-૨૦૨૦થી Integrated Management Public Distribution System અંતર્ગત નેશનલ પોર્ટેબિલિટી યોજના હેઠળ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગોવા, કેરળ, ત્રિપુરા સહિત ૧૨ રાજ્યનો લાભાર્થી કોઈ પણ રાજ્યમાંથી પોતાને મળવાપાત્ર અનાજનો ૫૦% જથ્થો પ્રથમ તબક્કે મેળવી શકે છે.

રેશનકાર્ડ ધારકો મળવાપાત્ર જથ્થા બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેકટરશ્રીને (RAC)ને ફરિયાદ કરી શકશે.

ઉક્ત અધિકારીશ્રીના નિર્ણયથી નારાજ થયેલ ઢોય તો તે અંગેની અપીલ ગુજરાત રાજ્ય અન્ન આયોગ, 'અન્ન ભવન' ટાઉનઢોલની બાજુમાં સેક્ટર-૧७, ગાંધીનગર. ટે.નં. ૦૭૯-૨૩૨૫૮૪૮૩ પર તથા E-mail : sfc-gujarat@gujarat.gov.in પર કરી શકાશે. ટોલ ક્રી નંબર નં. ૧૮૦૦-૨૩૩-૦૨૨૨, નં. ૧૮૦૦-૨૩૩-૫૫૦ ખાસ નોંધ :

રાજ્યના NFSA (અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો) રેશનકાર્ડધારકો આધારકાર્ડ આધારિત ઓળખ આપી તેઓને મળવાપાત્ર અનાજ સમગ્ર રાજ્યમાં કોઈ પણ વાજબી ભાવની દુકાન પરથી મેળવી શકે છે. लियाभक, અન્ન અને નાગરિક પુરવઠા, ગાંધીનગર

# केन्द्रीय विद्यालय इफको, गांधीधाम

अंशकालिक / संविदा के आधार पर शिक्षकों का पेनल तैयार करने हेतु साक्षात्कार 2020-21

क्र.सं.	पद	साक्षात्कार की तिथि / स्थान	साक्षात्कार का समय		
1	प्राथमिक शिक्षक		समय : प्रात: 9:00 बजे से दोपहर 12:00 बजे तक । (Reporting & verification of Documents Time : 08:00 AM to 09:00 AM)		
2	कम्प्यूटर प्रशिक्षक				
3	<b>काउ</b> न्सलर	दिनांक : 18/03/2020 स्थान : केन्द्रीय विद्यालय इफको, गांधीधाम			
4	आर्ट क्राफ्ट / डान्स कोच				
5	योग प्रशिक्षक				
6	खेल-कूद कोच				
7	नर्स				
8	प्रशिक्षित स्नातक-शिक्षक	दिनांक : 18/03/2020	समय : अपराहन 12.30 बजे से 05.00 बजे तक		
	हिन्दी, अंग्रेजी, संस्कृत, गणित,	स्थान : केन्द्रीय विद्यालय इफको,	(Reporting & verification of Documents		
	विज्ञान, सामाजिक विज्ञान ।	गांधीधाम	Time : 11:00 AM to 12:00 Noon)		

अभ्यर्थी को हिन्दी और अंग्रेजी दोनों भाषाओं में अध्यापन की दक्षता होनी चाहिए।

Website : http://www.iffcogandhidham.kvs.ac.in पर उपलब्ध है ।

16-03-2020 मध्याहन 12:00 बजे के बाद प्राप्त हुए आवेदन स्वीकार नहीं किए जायेंगे।

• साक्षात्कार के लिए पात्र उमीदवारों की सुचि केन्द्रीय विद्यालय इफको, गांधीधाम की

Website: http://www.iffcogandhidham.kvs.ac.in पर 17-03-2020 साय 02:00 बजे तक जारी की जायेगी।

केन्द्रीय विद्यालय इफको-Kendriya vidyalaya IFFCO

GANDHIDHAM-370203



# જ્ઞાનમંજરી કેરીયર એકેડર્મ

ગુજરાતી માધ્યમ

**English Medium** 

Result of JEE MAIN (2020)

Students GOT 90 P'Tile in

JEE RESULT (2020)

99<sup>UP</sup> P'Tileમેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 03

95<sup>UP</sup> P'Tile મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 63

90<sup>UP</sup> P'Tile મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા **124** 

Admission Analysis for Last 3 Years

કાળવીબીડ, ભાવનગર. ફોન : Mob. 9099941251, 8980015310 Email: gyanmanjaribvn@gmail.com Web: www.gyanmanjarividyapith.edu.in

01

**Students Secured** Admission in Reputed Medical College

in MBBS Last Year (2019) Admission Analysis for Last 3 Years

2017 - 2018 - 2019

KEM MEDICAL COLLEGE, MUMBAI

JIPMER, PONDICHERRY 02 B.J.MEDICAL COLLEGE, AHMEDABAD 50 GOVT. MEDICAL COLLEGE, BHAVNAGAR 95 M. P. SHAH MEDICAL COLLEGE, JAMANAGAF 16 GOVT. MEDICAL COLLEGE, BARODA 31 GOVT. MEDICAL COLLEGE, SURAT 18 P. D. U. MEDICAL COLLEGE, RAJKOT 11 ALL GMERS MEDICAL COLLEGE 137 OTHERS MEDICAL COLLEGES... 249

ધોરણ 11 Science (Guj. / Eng. Medium) માં અભ્યાસ કરવા ઇચ્છક વિદ્યાર્થીઓ માટે Gyanmanjari Career Academy દ્વારા Science Aptitude Test (SAT - 2020) નું આયોજન કરેલ છે. જેનો Syllabus અને પરીક્ષા અંગેની વિગતો નીચે મુજબ છે. માર્ચ-2020 માં ધોરણ-10 ની પરીક્ષા આપી રહેલ તમામ વિદ્યાર્થીઓ SAT - 2020 માં બેસી શકશે.

SAT-2020નો અભ્યાસક્રમ અને પરીક્ષાની માહિતી Subject Syllabus | Marks ગણિત ધોરણ-10 ગુજરાત બોર્ડના પાઠચપુસ્તક विज्ञान સામાજીક વિજ્ઞાન !

SAT ની પરીક્ષાની કાર્ચવાહીની રૂપરેખા

કાળવીબીડ, ભાવનગર.

• **તારીખ : 19-03-2020**,\* ગુરુવાર • સਮય : 9.00 am થੀ 11.00 am • સ્થળ : જ્ઞાનમંજરી કેરીયર એકેડમી, SAT માં માત્ર Objective પ્રકારના પ્રશ્નો રહેશે. વિદ્યાર્થીએ OMR માં વર્તૂળ ઘુંટીને પ્રશ્નોનાં જવાબ આપવાનાં રહેશે. ▶ ધોરણ-10 ની બોર્ડની પરીક્ષાની ઓરીજનલ રસીદ (રીસીપ્ટ)

આધારીત રહેશે.

અને ઝેરોક્ષ પણ સાથે લઇને આવવાનું રહેશે. ¥ (અગાઉ તા.18/03/2020 ના રોજ SAT-2020 માટેની જાહેરાત કરવામાં આવેલ. પરંતુ બોર્ડની પરીક્ષાને ધ્યાને લઇ તારીખમાં ફેરફાર કરેલ છે.)

CBSE અને ICSE બોર્ડની પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીઓ માટે પણ SAT નું આયોજન તા. 22/3/2020 રવિવાર અને તા. 31/3/2020 મંગળવારના રોજ ઉપરોક્ત સ્થળે એને સમયે કરેલ છે. બેમાંથી કોઇપણ એક દિવસે પરીક્ષા આપી શકશો. તેમનો અભ્યાસક્રમ તેમનાં બોર્ડ મુજબનો રહેશે.

#### SAT-2020 रिष्ट्रिशन भाटे

1, www. gyanmanjarividyapith.edu.in પર login કરી શકો છો. 2. સંસ્થાનો સંપર્ક કરી રૂબરૂ પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. 3. રજિસ્ટ્રેશન માટે બાજુમાં દર્શાવેલ QR code નો ઉપયોગ કરી શકશો.

નોંધ : ઉપરોક્ત ત્રણેય પઘ્ધ્ધતિમાંથી કોઇપણ એકમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરી શકે એમ હોય તેમનું પરીક્ષા સમયે સ્થળ પર સ્પોટ રજીસ્ટ્રેશનની વ્યવસ્થા રાખેલ છે.



વિશેષ માહિતી અને માર્ગદર્શન માટે તા.19/3/2020 ને ગુરૂવારે (એન્ટ્રન્સ ટેસ્ટનાં દિવસે) સવારે 11.00 કલાકે શાળા પર વિદ્યાર્થી-વાલી માટે સેમીનાર સેમીનારનું આયોજન કરેલ છે. દરેક વિદ્યાર્થી-વાલીએ ઠાજર રહેવા વિનંતી.

બહારગામનાં વિદ્યાર્થીઓ માટે સંસ્થાની હોસ્ટેલ સુવિદ્યા ઉપલબ્ધ છે.

रिषरदेशन माटे वृह Code GYANMANJARI

2017 - 2018 - 2019 a'TII 06 NIT's 10 DA-IICT, GANDHINAGAR 36 02 PDPU, GANDHINAGAR 23 NIRMA, AHMEDABAD 31 DDIT, NADIYAD 52 OTHER ENGINEERING COLLEGES .. 539 699

વિશેષ માહિતી માટે સંસ્થા પર રવિવાર સિવાય સવારે 9 થી 4 માં રૂબરૂ અથવા મોબાઈલ નં. 94 2929 2063 પર સંપર્ક કરવો.

• पद से संबंधित न्यूनतम शैक्षणिक एवम अन्य योग्यताऐं केन्द्रीय विद्यालय इफको, गांधीधाम की

• आवेदनपत्र पर केन्द्रीय विद्यालय इफको, गांधीधाम की वेबसाइट से डाउनलोड कर संबंधित दस्तावेज संलग्न कर विद्यालय में 16-03-2020 मध्याहन 12:00 बजे तक Post / By Hand जमा करें ।

 इच्छ्क अभ्यार्थी प्रत्येक पद के लिए अलग-अलग आवेदन करें । • साक्षात्कार के लिए किसी भी प्रकार का यात्रा भत्ता / दैनिक भत्ता नहीं दिया जाएगा ।

प्राचार्य/PRINCIPAL